



# ગુજરાત જાહેર સેવા આયોગ

**પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી), વર્ગ-૨ (જા.ક.૩૮/૨૦૧૭-૧૮)**

## અગત્યની જાહેરાત

આયોગ દ્વારા તા.૧૫/૦૭/૨૦૧૭ નાં રોજ પ્રસિદ્ધ થયેલ જા.ક.૩૮/૨૦૧૭-૧૮ પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી), વર્ગ-૨ ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની જગ્યાઓમાં સરકારશ્રીના પત્ર ક્રમાંક : ડીવાયએસ-૧૦૨૦૧૪-૫૬૦-બ તા.૦૪/૦૮/૨૦૧૭ નાં પત્રથી કુલ જગ્યા પૈકી ૦૧ (એક) જગ્યા માજી સૈનિક માટે અનામત રાખવામાં આવેલ છે અને મૂળ જાહેરાતની જગ્યાઓમાં નીચે મુજબનો સુધારો પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સુધારા અન્વયે ફક્ત માજી સૈનિક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વાસ્તે માજી સૈનિક કેટેગરીના ઉમેદવારો કે જેમણે અગાઉ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ માજી સૈનિક કેટેગરી માટે અરજી કરેલ ન હોય તેવા તથા અગાઉ ઓનલાઇન અરજી કરેલ ન હોય તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા સૂચિત કરવામાં આવે છે. તથા તા.૧૫/૦૭/૨૦૧૭ નાં રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે કોઈપણ કારણોસર ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયેલ ઉમેદવારોને પણ આ સાથે ઓનલાઇન અરજી નોંધવા તક આપવામાં આવે છે. માજી સૈનિક કેટેગરીના ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન અરજી કરેલ હશે તેમને પુનઃ અરજી કરવાની રહેશે નહીં અને જો આવા કોઈ ઉમેદવાર પુનઃ અરજી કરશે અને છેલ્લે નોંધાયેલ અરજીને જ ધ્યાને લેતા કોઈ અપાત્રતા ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. વિશેષમાં તમામને ખાસ સૂચિત કરવામાં આવે છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશનની તક આપવાની બાબત સિવાય અન્ય તમામ કિસ્સા માટે કટ-ઓફ ડેટ તરીકે તા.૧૫/૦૭/૨૦૧૭ નાં રોજની જાહેરાત અન્વયે અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨/૦૮/૨૦૧૭ ને જ ગણવામાં આવશે, જેની તમામે નોંધ લેવી. આ માટે ઉમેદવારોએ <https://gpsc-ojas.gujarat.gov.in> પર તા.૦૮/૦૮/૨૦૧૭ (૧૩-૦૦ કલાક) થી તા.૧૫/૦૮/૨૦૧૭ (૧૩-૦૦ કલાક) દરમિયાન લોગ ઇન કરવાનું રહેશે. જગ્યાઓમાં ફેરફાર સહિતની બધી જ જોગવાઈઓ તા.૧૫/૦૭/૨૦૧૭ નાં રોજ પ્રસિદ્ધ થયેલ જા.ક.૩૮/૨૦૧૭-૧૮ મુજબની જ રહેશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તા. ૦૭/૦૮/૨૦૧૭

જગ્યાનું નામ	કુલ જગ્યાઓ	કક્ષાવાર જગ્યાઓ				કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ				કુલ જગ્યાઓ પૈકી અનામત	
		બિન અનામત (સામાન્ય)	સા. શૈ. પ. વ.	અનુ. જાતિ	અનુ. જન જાતિ	બિન અનામત (સામાન્ય)	સા. શૈ. પ. વ.	અનુ. જાતિ	અનુ. જન જાતિ	શારીરિક અશક્ત	માજી સૈનિક
પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારધારી), વર્ગ-૨ ગુજરાત રાજ્ય પોલીસ સેવા	૧૧૫	૬૦	૩૦	૦૮	૧૭	૨૦	૧૦	૦૨	૦૬	૦૦	૦૧